

13th August, 2023

To,
Listing Department
BSE Limited
25th Floor, P. J. Towers,
Dalal Street,
Mumbai – 400 001

To,
Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Security Code: 540923

Security Symbol: ASHOKAMET

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on 30th June, 2023.

Dear Sir/Madam,


Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the quarter ended on June 30, 2023 as per Regulation 47(1)(b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You.

Yours faithfully,

For Ashoka Metcast Limited



Ashok C. Shah
Managing Director
DIN: 02467830



Encl: As above

Ashoka Metcast Limited

Reg. Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Mithakhali Ahmedabad 380006. **Website:** www.ashokametcast.in
Email : info@ashokametcast.in **CIN :** L70101GJ2009PLC057642 **T :** 079 26463226

KEMISTAR CORPORATION LIMITED
604, MANAS COMPLEX, JODHPUR CROSS ROAD, SATELITE, AHMEDABAD-380015,
CIN : L24233GJ1994PLC022845; Phone : 079-26923570/87; Email : kemistars@gmail.com Website : www.kemistar.in
Extract of Unaudited Consolidated Financial Result for the Quarter ended on June 30, 2023
(Rs in Lakh, Except EPS)

Sr. No.	PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
		30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
1.	Total Income from Operations	209.69	218.69	579.37	1833.73
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional Items#)	7.69	16.71	50.71	114.20
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items#)	7.69	16.71	50.71	114.20
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items#)	7.69	4.24	43.47	83.90
5.	Total Comprehensive Income for the period	7.69	4.24	43.47	83.90
6.	Equity Share Capital	1075.94	1075.94	1075.94	1075.94
7.	Earnings Per Share of Rs.10/- each				
1.	Basic: (In Rs)	0.07	0.04	0.40	0.78
2.	Diluted: (In Rs)	0.07	0.04	0.40	0.78

Key Standalone Financials of the Company is as under

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
Total Income from Operations	31.06	158.49	81.35	385.52
Net Profit / (Loss) for the period before tax (after Exceptional Items#)	1.69	3.99	10.78	31.70
Net Profit / (Loss) for the period after tax (after Exceptional Items#)	1.36	3.06	7.97	23.03

Notes:
a. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated financial result for the quarter ended on 30.06.23 is available on the websites of www.bsindia.com and at www.kemistar.in.
b. The above financials were reviewed by the audit committee and approved by the Board of Directors in the meeting held on August 12, 2023.
c. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.
For, Kemistar Corporation Limited
DATE : August 12, 2023
PLACE : Ahmedabad
Ketan Patel, Managing Director, (DIN No: 01157786)

GLOBE TEXTILES (INDIA) LIMITED
(Regd. Office: Plot No. 38 to 41, Ahmedabad Apparel Park, GIDC Khokhra, Ahmedabad, Gujarat - 380008)
E-mail id : cs@globetextiles.net, Phone : 079-2293 1881 to 1885, website: www.globetextiles.net
(Rs. In Lakh) Except EPS and Face Value of Share)
Extract of Unaudited Financial Results for the quarter ended on June 30, 2023

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
Total Income from operations	12898.73	11139.32	11546.32	40183.18
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	183.35	82.75	206.14	565.86
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	183.35	82.75	206.14	565.86
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	146.31	76.39	160.74	450.53
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	150.45	85.41	158.26	467.08
Equity Share Capital	3022.83	3022.83	3022.83	3022.83
Other Equity (Including Revaluation Reserve)	-	-	-	2418.18
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinuing operations)				
Basic*	0.10	0.05	0.11	0.30
Diluted*	0.10	0.05	0.11	0.30

***EPS is not annualised for the quarterly results.**
Notes:
(1) The financial results for the quarter ended on June 30, 2023 have been reviewed by the Audit Committee on August 12, 2023, thereupon approved and taken on record by the Board of Directors. The Statutory Auditors of the Company have conducted a 'Limited Review' of the above Financial Results for the quarter ended June 30, 2023.
(2) The figures for the quarter ended March 31, 2023 represent the difference between the audited figures in respect of the full financial year and the unaudited published year-to-date figures upto the third quarter of the financial year, which were subjected to limited review.
(3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.globetextiles.net) and on the website of NSE Ltd (www.nseindia.com).
(4) Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules.
For, GLOBE TEXTILES (INDIA) LIMITED
Bhavik Suryakant Parikh,
Managing Director
DIN: 00038223
DATE : 12.08.2023
PLACE : Ahmedabad

ASHNISHA INDUSTRIES LIMITED
Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006.
CIN : L74110GJ2009PLC057629

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023. (Rs. In Lakhs)

Particulars	Quarter ending		Corresponding 3 months ended in the previous year	Year ended
	30.06.2023	31.03.2023		
Total Income from operations	266.99	2137.72	273.83	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	31.38	111.90	1.43	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	31.38	111.90	1.43	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	31.38	89.88	1.43	
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive Income (after tax))	31.38	89.88	1.43	
Equity Share Capital	990.00	990.00	301.88	
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)				
Basic:	0.032	0.09	0.05	
Diluted:	0.032	0.09	0.05	
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)				
Basic:	0.032	0.09	0.05	
Diluted:	0.032	0.09	0.05	

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023. (Rs. In Lakhs)

Particulars	Quarter ending		Corresponding 3 months ended in the previous year	Year ended
	30.06.2023	31.03.2023		
Total Income from operations	217.63	719.70	75.14	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	30.24	80.02	25.24	
Profit after tax	30.24	67.18	25.24	

Notes:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bsindia.com) and the company's website (www.ashnisha.in)
For, ASHNISHA INDUSTRIES LIMITED SD/-
ASHOK C. SHAH
DIRECTOR
DIN: 02467830
Date : 12/08/2023
Place : Ahmedabad

Shri Parshottam Rupala briefs media on 9 Years' Key achievements and initiatives of Department of Animal Husbandry and Dairying

India has vast resource of livestock and poultry, which play a vital role in improving the socio-economic conditions of rural masses. Livestock forms an important livelihood activity, supplementing income, offering employment opportunities. Agriculture diversification through animal husbandry is one of the primary drivers of growth in rural incomes. Union Minister Shri Parshottam Rupala said while addressing media that the Department of Animal Husbandry and Dairying has taken several important initiatives during the last nine years for improvement of per animal productivity. Increase in productivity will help in production of more Milk, meat and livestock products for the domestic market and export market. The department is implementing several programs for complete control and eradication of major livestock diseases and Infrastructure Development. The Department is also dovetailing and synergizing efforts with other Ministries and stakeholders especially in the context of common objective of helping the farmers increase their income through the livestock sector. The Department of Animal Husbandry and Dairying stands committed to work with all the stakeholders and will provide maximum support for delivering the Quality Services at Farmers' Doorstep.

Key achievements and initiatives of the Department of Animal Husbandry and Dairying under various Schemes/Programmes are as follows:
Livestock Sector
Livestock Sector is an important subsector of agriculture in the Indian economy. It grows at a Compound annual growth rate (CAGR) of 7.93 per cent during 2014-15 to 2020-21 (at constant prices). The contribution of livestock in total agriculture and allied sector Gross v12:11:5027-06-2023 value added (GVA) (at constant prices) has increased from 24.38 per cent (2014-15) to 30.87 per cent (2020-21). Livestock sector contributed 6.2 per cent of total GVA in 2020-21.

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION
PROVISION OF MONITORING AND SURVEILLANCE SYSTEM
For and on behalf of the President of India, Chief Mechanical Engineer, carriage Repair Workshop, Bhavnagar Para, Western Railway, E-tender for below work: E-Tender No. BVPWMLB-42/CTIV-R, Name of the Work: Provision of Monitoring and Surveillance System with CAMC at Bhavnagar Para, Bhavnagar Para, Western Railway. Approximate cost of work: ₹ 1,15,20,000/- Bid Security: ₹ 2,06,800/- Tender Document Fees ₹ 0.00. Validity of tender offer: 60 Days. Completion of work in 90 days from the date of issue of L.O.A. Last date & time for Submission & Opening of tender: 29-08-2023, 11:00 Hrs. and 29-08-2023, 11:30 Hrs. Issued by: Deputy Chief Mechanical Engineer, Office of Chief Workshop Manager, Carriage Repair Workshop, Bhavnagar Para, Western Railway. Important Note: The tender shall be submitted only Electronically on the website of e-procurement portal. Manual offers are allowed against this E-tender, and any such manual offer received at this office shall be ignored and not opened.
Like us on: Facebook.com/WesternRly Follow us on: Twitter.com/WesternRly

Livestock Population
There are about 303.76 million bovines (cattle, buffalo, mithun and yak), 74.26 million sheep, 148.88 million goats, 9.06 million pigs and about 851.81 million poultry as per 20th Livestock Census in the country.

Dairy is the single largest agricultural commodity contributing 5 per cent of the national economy and employing more than 8 crore farmers directly. India is ranked 1st in milk production contributing 23 per cent of global milk production. Milk production has increased by 51.05% over the past 8 years from 146.3 million tonnes during 2014-15 to 221.06 million tonnes during 2021-22. Milk production is growing at the annual growth rate (CAGR) of 6.1% over the past 8 years whereas world milk production is growing at 1.2% per annum. The per capita availability of milk is 444 grams per day in 2021-22 as against the world average of 394 grams per day during 2021. Egg and Meat Production According to Food and Agriculture Organization Corporate Statistical Database (FAOSTAT) production data (2020), India ranks 3rd in Egg Production and 8th in meat production in the world. Egg production in the country has increased from 78.48 billion Nos. in 2014-15 to 129.60 billion Nos. in 2021-22. Egg production in the country is growing at the rate (CAGR) of 7.4% per annum. The per capita availability of egg is at 95 eggs per annum in 2021-22. Meat production in the country has increased from 6.69 million tonnes in 2014-15 to 9.29 million tonnes in 2021-22.

Nationwide Artificial Insemination Programme-Delivery of Artificial Insemination Services at Interventions of Rashtriya Gokul Mission

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION
VARIOUS WORKS IN CONNECTION WITH INTERLOCKING OF LG GATE DRMS and T acting for and behalf of the President of India invites E-Tenders against tender No. DRM-Snt-AD-Sig 05 of 2023-24 closing date 05-09-2023, 15:00 Bidders will be able to submit their original/bid copy upto closing date and time only. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. Tender No. DRM-Snt-AD-Sig 05 of 2023-24 (1) Name of Work: Part supply of signaling material, installation, testing and commissioning in connection with Interlocking of LG Gate No. 90 between Khakhruchi (KHKR) - Vadnara (VDRH) section in Ahmedabad Division. (2) Estimated Cost of Work: ₹ 67,68,744.28/- (Rs Sixty Seven Lakh Six Thousand Seven Hundred Forty Four Rupees and Twenty Nine Paise only) (3) Earnest Money Deposit: ₹ 1,35,300/- (Rs. One Lakh Thirty Five Thousand Three Hundred only) (4) Date & Time of closing of tender and opening of tender: Not later than 15:00 hrs of 05-09-2023 and Opening on 05-09-2023 at 15:30 hrs. (5) Website of E-Tendering: www.tenders.in (6) Date: 11/08/2023 Place : Ahmedabad

Farmers Doorstep: As on date, 5.71 crore animals have been covered, 7.10 crore Artificial Insemination have been performed and 3.74 crore farmers benefitted under the programme.

Promotion of IVF Technology in the country: So far, 19248 viable embryos produced, 8661 viable embryos transferred and 1343 calves are born under the programme.

Sex sorted semen production: Sex sorted semen production has been introduced in the country for production of only female calves upto 90% accuracy.

MAITRI ENTERPRISES LIMITED
CIN: L45208GJ1991PLC016853
Registered Office : 'Gayatri House', Ashok Vihar, Near Maitri Avenue Society, Opposite Government College, Motera, Sabarmati, Ahmedabad - 380005, Gujarat.
E-mail id : compliance@maitrienterprises.com, Phone : 079-2750680/2751340, website : www.maitrienterprises.com
Extract of Consolidated Un-Audited Financial Results for the Quarter ended June 30, 2023

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
Total income from operations (net)	348.84	407.88	295.02	1343.87
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(0.84)	12.08	9.13	16.50
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.84)	12.08	9.13	16.50
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.84)	7.20	6.21	(0.11)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.84)	7.20	6.21	(0.11)
Equity Share Capital	440.00	440.00	440.00	440.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	56.84
Basic:	(0.02)	0.16	0.14	(0.01)
Diluted:	(0.02)	0.16	0.14	(0.01)

Extract of Consolidated Un-Audited Financial Results for the Quarter ended June 30, 2023

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
Total income from operations	317.30	346.28	179.40	993.38
Profit Before Tax	7.64	217.19	11.60	46.77
Profit After Tax (After Other Comprehensive Income)	5.72	16.77	8.68	33.72

Notes: The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended on June 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company i.e. www.maitrienterprises.com and on the website of BSE Ltd (www.bsindia.com)
For, MAITRI ENTERPRISES LIMITED SD/-
MR. JAIKISHAN R. AMBIVANI,
MANAGING DIRECTOR
DIN: 03592860
DATE : August 12, 2023
PLACE : Ahmedabad

ASHOKA METCAST LIMITED
CIN : L70101GJ2009PLC057642
Registered Office: 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

Particulars	Quarter ending		Corresponding 3 months ended in the previous year	Year ended
	30.06.2023	31.03.2023		
Total Income from operations	1422.05	1925.43	1945.30	5138.84
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	71.59	155.00	42.00	406.11
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	71.59	155.00	42.00	406.11
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	63.77	131.75	42.00	308.55
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	71.16	124.62	43.30	322.07
Equity Share Capital	2499.50	2499.60	1741.00	2499.60
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)				
Basic:	0.28	0.50	0.25	1.28
Diluted:	0.28	0.50	0.25	1.28
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised)				
Basic:	0.28	0.50	0.25	1.28
Diluted:	0.28	0.50	0.25	1.28

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023. (Rs. In Lakhs)

Particulars	Quarter ending		Corresponding 3 months ended in the previous year	Year ended
	30.06.2023	31.03.2023		
Total Income from operations	73.05	268.03	11.92	291.96
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	0.54	0.84	6.25	9.29
Profit after tax	0.54	0.84	6.25	9.14

Notes:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bsindia.com) and the company's website (www.ashokametcast.in)
For, ASHOKA METCAST LIMITED SD/-
ASHOK C. SHAH
MANAGING DIRECTOR
DIN: 02467830
Date : 11/08/2023
Place : Ahmedabad

AKASH INFRA-PROJECTS LIMITED
Regd. Office: 2, GROUND FLOOR, ABHISHEK COMPLEX, OPP. HOTEL HAVELI, SECTOR-11, GANDHINAGAR - 382011, GUJARAT INDIA
CIN: L45209GJ1999PLC036003, Ph. No.: +91-79-2327006, Fax: +91-79-23231006
Website: www.akashinfra.com, E-Mail: info@akashinfra.com

Extract of Statement of Standalone and Consolidated Un-Audited Financial Results for the quarter ended on 30.06.2023
(Rs. in lakhs Except per Share Data)

Sr. No.	Particulars	Standalone		Consolidated		Year ended
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023	
1.	Total Income	2,440.93	3,342.43	2,935.32	6,277.33	3,442.53
2.	Net Profit / (Loss) for the Period (before Tax, Exceptional and Extraordinary Items)	(121.91)	12.28	98.26	175.07	(121.61)
3.	Net Profit / (Loss) for the Period (before Tax after Exceptional and Extraordinary Items)	(121.91)	12.28	98.26	175.07	(121.61)
4.	Net Profit / (Loss) for the period after tax	(121.84)	2.95	80.61	141.38	(121.39)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(120.81)	6.39	80.83	145.48	(121.42)
6.	Paid-up Equity Share Capital of Face Value Rs.10/- Each	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25
7.	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	0.00	0.00	0.00	3,999.03	0.00
8.	Earnings Per Equity Share (Not Annualised): Basic	-0.72	0.04	0.48	0.86	-0.72
8.	Earnings Per Equity Share (Not Annualised): Diluted	-0.72	0.04	0.48	0.86	-0.72

Notes:
1. The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the Quarter and half year ended on 30.06.2023 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Un-Audited Financial Results for the aforesaid Quarter are available on the Stock Exchange website i.e. www.bsindia.com and on the website of the Company i.e. www.akashinfra.com
2. The above results have been reviewed by the Audit Committee of the Directors and approved by the Board of Directors at their meeting held on August 12, 2023.
For Akash Infra Projects Limited
YOGKUNAR HARIBHAI PATEL
MANAGING DIRECTOR
DIN: 00465335
Date : August 12, 2023

શા માટે અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંકવા માટે હિરોશિમા અને નાગાસાકી પસંદ કર્યા?

૦૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પહેલો અણુ બોમ્બ ફેંક્યો હતો. આનાથી માત્ર જાપાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હચમચી ગયું હતું. ૦૩ ડિસેમ્બરના નાગાસાકી પર પણ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એક જગતકે લાખો લોકો માર્યા ગયા. તેના કરતાં વધુ, તેઓ બોમ્બના કારણે થતા રેડિયેશનથી માર્યા ગયા હતા. આ ઘટના ૮૬ વર્ષ પહેલા બની હતી. પરંતુ આ એક એવી ઘટના છે જેને વહીવટી રીતે સમજી શકાય છે. મહત્વનું છે કે આ બાદી પછી જ સમગ્ર એશિયામાં

શહેરના કેન્દ્રની નજીક છોડવામાં આવ્યો હતો, જેના કારણે ૮૦ હજાર લોકોના મોત થયા હતા. જેથી કેટલાય ધાયલ થયા. ત્રણ દિવસ પછી, એક જાપાનીસ જાહ પર સવાર ૧૧ વાગે બોમ્બ ફેંકવામાં આવ્યો, ત્રણ દિવસ પછી, ફેટ મેન નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો, જેમાં ૪૦,૦૦૦ લોકો માર્યા ગયા. સર્વે અનુસાર, નાગાસાકીમાં નુકસાન વધુ જ કરવામાં આવ્યું હતું કારણ કે બોમ્બ લોકો કામે જતા હતા. બાળકો પણ શાળાએ પહોંચ્યા હતા. એક અમેરિકન સર્વે અનુસાર, આ બોમ્બ

માર્ગે સુધીની હતી. તેમ છતાં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર શા માટે અણુ બોમ્બ ફેંક્યા આ પ્રશ્નના જવાબ પર થવા નીચેના છે. ૧૯૪૫માં અમેરિકા અને જાપાન વચ્ચે ત્રણ તારા ઘણી વધી હતી. જાપાને ઈન્ડોચીના સૈન્ય પર કબ્જો જમાવવાની યોજના અપનાવી હતી. જાપાને અમેરિકા પર ઘણું ધમકાવું કર્યું હતું. તત્કાલીન યુએસ પ્રમુખ હેરી ટ્રુમેનને યુદ્ધમાં જાપાનને શરણાપીઠમાં મરદ કરવા માટે અણુ બોમ્બનો ઉપયોગ કરવાની સાથે આપવામાં આવી હતી. ટ્રુમેનને જાપાનને ચેતવણી આપી હતી કે, જો તે આત્મસંપર્કમાં નહીં કરે તો અમેરિકા જાપાનના કોઈપણ શહેરને સંપૂર્ણ રીતે નાશ કરવા તૈયાર છે. જો જાપાને તેની શરતો ન સ્વીકારી તો તે હવામાં વિનાશનો વરસાદ જોવા તૈયાર હતો. એ સંજોગોમાં જાપાને કોઈ સંમતિમાં થઈ ન હતું. ત્યાંજ અમેરિકાએ બોમ્બ ફેંકવાનું નક્કી કર્યું હતું. ૨ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ અમેરિકાએ હિરોશિમા પર અને ૯મી ઓગસ્ટે નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા. પરંતુ આ એક અભિપ્રાય પણ છે કારણ કે, આ બાબતમાં કેટલાક અન્ય અભિપ્રાયો

પણ છે જે અમેરિકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ ફેંકવાનું અલગ કારણ આપે છે. ઈતિહાસકાર ગાર અલ્બોર્સિટીએ તેમના ૧૯૯૫ના પુસ્તકમાં દલીલ કરી હતી કે તે સમયે અમેરિકા હારી રહ્યું હતું, પરંતુ અમેરિકા યુદ્ધ પછી સત્તાની બાબતમાં સંતોષિત યુનિયનને પાછળ છોડવા માંગતું હતું. તેથી જ તેની સાથે આ પ્રશ્નોનો 'શો ઝોલે સ્ટ્રેચ' કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે

આ અભિપ્રાય તે સમયે સંતોષિત કરવામાં આવે, વહરરી ઉત્પાદન બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે દેશની બીજી સેના અને સુબોડે સેનાનું મુખ્ય મથક હતું. તેમાં બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે

ડિસાના વાસણા ગામે બનાસ નદીમાં ડુબેલા યુવકની લાશ તરવેયાઓએ બહાર કાઢી, નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો

અમદાવાદ, ડિસા તાલુકાના વાસણા ગામે બહાર વાસણા નદીમાં ડુબેલા યુવકની લાશ તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો. ગામે રહેતો શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો. ગામે રહેતો શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો. ગામે રહેતો શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો.

શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો. ગામે રહેતો શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો. ગામે રહેતો શેઠમ પટ્ટણી નામનો ૧૮ વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બહાર વાસણા નદીમાં તરવેયાઓએ બહાર કાઢી હતી. નિષ્ફળ વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે આકોશ છવાયો.

પણ છે જે અમેરિકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ ફેંકવાનું અલગ કારણ આપે છે. ઈતિહાસકાર ગાર અલ્બોર્સિટીએ તેમના ૧૯૯૫ના પુસ્તકમાં દલીલ કરી હતી કે તે સમયે અમેરિકા હારી રહ્યું હતું, પરંતુ અમેરિકા યુદ્ધ પછી સત્તાની બાબતમાં સંતોષિત યુનિયનને પાછળ છોડવા માંગતું હતું. તેથી જ તેની સાથે આ પ્રશ્નોનો 'શો ઝોલે સ્ટ્રેચ' કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે

આ અભિપ્રાય તે સમયે સંતોષિત કરવામાં આવે, વહરરી ઉત્પાદન બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations (net)	348.84	407.88	295.02	1343.87
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.84)	12.08	8.13	15.50
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(0.84)	12.08	8.13	15.50
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(0.84)	7.20	6.21	(0.11)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.84)	7.20	6.21	(0.11)
Equity Share Capital	440.00	440.00	440.00	440.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	56.84
Basic:	(0.02)	0.16	0.14	(0.01)
Diluted:	(0.02)	0.16	0.14	(0.01)

PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED	
	30/06/2023	31/03/2023	30/06/2022	31/03/2023
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations	12899.73	11139.32	11546.32	40183.18
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	183.35	82.75	206.14	565.86
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	183.35	82.75	206.14	565.86
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	146.31	76.39	160.74	450.53
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	150.45	85.41	158.26	467.08
Equity Share Capital	3022.83	3022.83	3022.83	3022.83
Other Equity (Including Revaluation Reserve)	-	-	-	2418.18
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)				
Basic*	0.10	0.05	0.11	0.30
Diluted*	0.10	0.05	0.11	0.30

પણ છે જે અમેરિકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ ફેંકવાનું અલગ કારણ આપે છે. ઈતિહાસકાર ગાર અલ્બોર્સિટીએ તેમના ૧૯૯૫ના પુસ્તકમાં દલીલ કરી હતી કે તે સમયે અમેરિકા હારી રહ્યું હતું, પરંતુ અમેરિકા યુદ્ધ પછી સત્તાની બાબતમાં સંતોષિત યુનિયનને પાછળ છોડવા માંગતું હતું. તેથી જ તેની સાથે આ પ્રશ્નોનો 'શો ઝોલે સ્ટ્રેચ' કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે

આ અભિપ્રાય તે સમયે સંતોષિત કરવામાં આવે, વહરરી ઉત્પાદન બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે

Particulars	Quarter ending		Year ended	
	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	1422.05	1925.43	1945.30	5118.84
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	71.59	155.00	42.00	406.11
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	71.59	155.00	42.00	406.11
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	63.77	131.75	42.00	308.55
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	71.16	124.62	43.30	322.07
Equity Share Capital	2499.60	2499.60	1754.00	2499.60
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	0.28	0.50	0.25	1.28
Basic:	0.28	0.50	0.25	1.28
Diluted:	0.28	0.50	0.25	1.28
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	0.28	0.50	0.25	1.28
Basic:	0.28	0.50	0.25	1.28
Diluted:	0.28	0.50	0.25	1.28

Sr. No.	Particulars	Rs. in lakhs		
		Quarter ended Unaudited 30-Jun-23	Quarter ended Unaudited 30-Jun-22	Year ended Audited 31-Mar-23
1	Total income from operations (net)	1,084	1,380	6,926
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional Items)	6	(13)	20
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	6	(17)	20
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	(7)	(18)	5
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(8)	(19)	7
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1,134	1,134	1,134
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	1,846	1,831	1,854
8	Earnings Per Share (of Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(0.07)	(0.17)	0.06
9	Basic (in Rs/Share)	(0.07)	(0.17)	0.06
10	Diluted (in Rs/Share)	(0.07)	(0.17)	0.06

Particulars	Quarter ending		Previous Year ended		Corresponding 3 months ended in the previous year
	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2022	
	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited
Total income from operations	266.99	2137.77	273.83		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	31.38	113.90	1.43		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	31.38	113.90	1.43		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	31.38	89.88	1.43		
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	31.38	89.88	1.43		
Equity Share Capital	990.00	990.00	301.85		
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualized)	0.032	0.09	0.05		
Basic:	0.032	0.09	0.05		
Diluted:	0.032	0.09	0.05		
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualized)	0.032	0.09	0.05		
Basic:	0.032	0.09	0.05		
Diluted:	0.032	0.09	0.05		

પણ છે જે અમેરિકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ ફેંકવાનું અલગ કારણ આપે છે. ઈતિહાસકાર ગાર અલ્બોર્સિટીએ તેમના ૧૯૯૫ના પુસ્તકમાં દલીલ કરી હતી કે તે સમયે અમેરિકા હારી રહ્યું હતું, પરંતુ અમેરિકા યુદ્ધ પછી સત્તાની બાબતમાં સંતોષિત યુનિયનને પાછળ છોડવા માંગતું હતું. તેથી જ તેની સાથે આ પ્રશ્નોનો 'શો ઝોલે સ્ટ્રેચ' કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે

આ અભિપ્રાય તે સમયે સંતોષિત કરવામાં આવે, વહરરી ઉત્પાદન બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે

Sr. No.	Particulars	Standalone		Consolidated	
		Quarter ended Unaudited 30.06.2023	Quarter ended Unaudited 30.06.2022	Quarter ended Unaudited 30.06.2023	Quarter ended Unaudited 30.06.2022
1	Total Income	2,440.93	1,342.42	6,277.33	2,442.53
2	Net Profit for the Period (before Tax, Exceptional and Extraordinary Items)	(121.91)	12.28	98.26	175.07
3	Net Profit for the Period (before Tax after Exceptional and Extraordinary Items)	(121.91)	12.28	98.26	175.07
4	Net Profit / (Loss) for the period after tax	(121.84)	2.95	80.61	131.39
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(120.81)	6.39	80.83	145.48
6	Paid-up Equity Share Capital of Face Value Rs. 10/- Each	1,686.25	1,686.25	1,686.25	1,686.25
7	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	0.00	0.00	0.00	6,399.03
8	Earnings Per Equity Share (Not Annualized): Basic	-0.72	0.04	0.48	-0.72
9	Earnings Per Equity Share (Not Annualized): Diluted	-0.72	0.04	0.48	-0.72

Particulars	Quarter ending		Year ended	
	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2023
	Unaudited	Audited	Unaudited	Audited
Total income from operations	73.05	268.03	11.92	291.96
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	0.54	0.84	6.25	9.29
Net Profit after tax	0.54	0.84	6.25	9.14

Particulars	Quarter ending		Previous Year ended		Corresponding 3 months ended in the previous year
	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2022	
	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited
Total income from operations	217.63	719.70	75.14		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	30.24	80.02	25.24		
Net Profit after tax	30.24	67.18	25.24		

પણ છે જે અમેરિકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ ફેંકવાનું અલગ કારણ આપે છે. ઈતિહાસકાર ગાર અલ્બોર્સિટીએ તેમના ૧૯૯૫ના પુસ્તકમાં દલીલ કરી હતી કે તે સમયે અમેરિકા હારી રહ્યું હતું, પરંતુ અમેરિકા યુદ્ધ પછી સત્તાની બાબતમાં સંતોષિત યુનિયનને પાછળ છોડવા માંગતું હતું. તેથી જ તેની સાથે આ પ્રશ્નોનો 'શો ઝોલે સ્ટ્રેચ' કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે

આ અભિપ્રાય તે સમયે સંતોષિત કરવામાં આવે, વહરરી ઉત્પાદન બે શહેરો, હિરોશિમા અને નાગાસાકીને જ પસંદ કરવા પાછળ શિકેરો કારણ હતા. ટ્રુમેન ઈન્ડિયા શિકેરોમાં આ માટે યોગ્ય હતા. જાપાનનું સામું સૈન્ય મોટું શહેર, આ બાબતે